



# એડમીશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સ(ટેકનીકલ )

એલ.ડી કોલેજ ઓફ એન્જિનિયરીંગ કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ -૩૮૦ ૦૧૫

ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમો ચલાવતી નવી મંજૂરી ધરાવતી સ્વનિર્ભર સંસ્થાઓ ની બેઠકો પર પ્રવેશ બાબતે  
(પ્રવેશ વર્ષ ૨૦૨૨-૨૩)

પ્રથમ વર્ષ ૨૦૨૨માં ડિગ્રી તથા ડિપ્લોમા ફાર્મસીના અભ્યાસક્રમની તા.૩૦/૧૧/૨૦૨૨ ના રોજ ઓનલાઇન બીજા રાઉન્ડ ની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયેલ છે. ત્યારબાદ ખાલી રહેલી બેઠકો ગુજરાત વ્યવસાયિક ટેકનીકલ કોલેજો/સંસ્થાઓ(પ્રવેશનિયમન અને ફી ચુકવણી) નિયમ મુજબ “ખાલી બેઠકો” મુજબ ભરવાની કાર્યવાહી નો કાર્યક્રમ પ્રસિધ્ધ થઈ ચૂકેલ છે. ત્યારબાદ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા આને માન. સર્વોચ્ચ ન્યાયાલય ના આદેશાનુસાર રાજ્યની ૧૮ જેટલી નવી સંસ્થાઓને નવી બેઠકોની મંજૂરી પ્રાપ્ત થયેલ છે. જેમાં પ્રવેશ ની છેલ્લી તારીખ ૩૧.૧૨.૨૦૨૨ રહેશે. જેના અનુસંધાને “ઉક્ત બેઠકો” નો પ્રવેશ કાર્યક્રમ નીચે મુજબ છે.ઉક્ત સંસ્થાઓ ની સરકારી બેઠકો (મંજૂર બેઠકોના ૫૦%) નો એક રાઉન્ડ પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવશે. જેમાં પ્રથમ વર્ષ ડિગ્રી તથા ડિપ્લોમા ફાર્મસીના પ્રવેશ વર્ષ-૨૦૨૨ના મેરીટ સમાવિષ્ટ તમામ ઉમેદવારો ભાગ લઈ શકશે. આ પ્રવેશ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ વેબસાઇટ [www.gujacpc.nic.in](http://www.gujacpc.nic.in) પર પોતાના લોગીન આઈડી (LOGIN ID) ની મદદથી પ્રવેશ સમિતિ એ નિયત કરેલ સમય મર્યાદામાં ઓનલાઇન સંમતિ (Consent) reshuffling પર ક્લિક કરી ને આપવાની રહેશે તથા વિદ્યાર્થીએ ફક્ત આજ સંસ્થાઓ માટે નવેસરથી ચોઈસ ફીલિંગ કરવાની રહેશે.અગાઉનો પ્રવેશ રદ થયા બાદ ઉમેદવારોને ફી રીફંડ સરકારશ્રીના પ્રવેશ અંગેના જાહેરનામા ના નિયમ "Cancellation Of Admission And Refund Of Fees" પ્રમાણે થશે. ઉક્ત સંસ્થાઓ ની યાદી આ સાથે સામેલ છે.

## પ્રવેશ કાર્યક્રમ :

Sr. No.	Activities	Date
1	Seat information	21.12.2022
2	Online Consent and filling or alternation of fresh choices ( <a href="http://www.gujacpc.nic.in">www.gujacpc.nic.in</a> )	21.12.2022 to 23.12.2022 (12 noon)
3	Allotment of Admission ( <a href="http://www.gujacpc.nic.in">www.gujacpc.nic.in</a> )	23.12.2022 (6 PM)
4	Confirmation of admission by Paying Token Tuition fees (if any) ( <a href="http://www.gujacpc.nic.in">www.gujacpc.nic.in</a> )	23.12.2022 (6PM) to 25.12.2022
5	Declaration of Vacant seats and admission on vacant seat at respective institutes as per Admission Rules	26.12.2022 to 31.12.2022
6	Filling up Management seats at respective institute as per Admission Rules	21.12.2022 to 26.12.2022

વધુ માહિતી માટે ઉમેદવારો તથા વાલીઓ ને સમીતી ની વેબસાઇટ [www.jacpcldce.ac.in](http://www.jacpcldce.ac.in) અને [www.gujacpcnic.in](http://www.gujacpcnic.in) જોવા જણાવવા મા આવે છે.

તા. ૨૧.૧૨.૨૦૨૨

- મેમ્બર સેક્રેટરી

**Help Line Number : 079-26566000 (24 × 7)**